

B.Com. Semester - 5 (Remedial) (CBCS) Examination
March/April-2023 (NEW COURSE)
Indirect Tax Law - 1(Dse-3)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

-
- પ્રશ્ન.1 ભારતમા GST ની જરૂરીયાતોની ચર્ચા કરી તેની બંધારણી જોગવાઈઓ વર્ણવો. (20)
 અથવા
- પ્રશ્ન.1 પરોક્ષ કર એટલેશું? તેની લક્ષણીકતાઓ વર્ણવો.
- પ્રશ્ન.2 GST કંપોઝીશન સ્કીમના ફાયદા અને મર્યાદા જણાવો. (20)
 અથવા
- પ્રશ્ન.2 અવેજ સાથેનો પુરવઠો અને અવેજ વગરનો પુરવઠો સમજાવો.
- પ્રશ્ન.3 ફોરવર્ડ ચાર્જ અન્વયે સેવાના સમયનો પુરવઠો સમજાવો. (15)
 અથવા
- પ્રશ્ન.3 ફોરવર્ડ ચાર્જ અન્વયે વસ્તુના સમયનો પુરવઠો સમજાવો.
- પ્રશ્ન.4 કિંમત પુરવઠા અન્વયે નીચેના પર નોંધ લખો. (કોઈ પણ બે) (15)
 (1) વ્યવહારનું મુલ્ય.
 (2) નાણું.
 (3) એજન્ટ
 (4) અવેજ

English Version

- Q-1 Discuss need for GST in India describe its Constitution Provision. (20)
 OR
- Q-1 What is Indirect tax? Describe its features.
- Q-2 State merits and demerits of composition scheme under GST. (20)
 OR
- Q-2 What is supply with consideration and supply without consideration?
- Q-3 Explain time of supply of service under forward charge. (15)
 OR
- Q-3 Explain time of supply of Goods under forward charge.
- Q-4 Write a note under value of supply. (Any Two) (15)
 (1) Transaction value.
 (2) Money.
 (3) Agent.
 (4) Considerations.
